



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૦૩/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૧૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૧૦ કેસ કરી, ૧૧૧ વ્યક્તિઓને ઝડપી, ૭૪૨ લીટર દેશી દારૂ, ૧૨૨ બોટલ ઇંગ્લીશ દારૂ, ૬૧ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૧ મોટર સાયકલ અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૫ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૮,૦૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૧૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૧૧૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૫૧૪/૧૯

વસ્ત્રાપુર: હાઈકોર્ટના રમેશભાઈ પારેખ (રહે.સરદાર રોડ ફળીયુ-મોટી ભાગોળ ગામ-સુણાવ તા-પેટલાદ જીલ્લો-આણંદ) એ તા.૨૦/૦૩/૧૯ ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૧૧/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન બોડકદેવ ચાર રસ્તાની બાજુમા મધર મિલ્ક પેલેસ સામે આવેલ પ્રાઇમેટ કોમ્પ્લેક્ષ ખાતે આરોપી રાહુલ પ્રીયકાન્તભાઈ શાહે હાઈકોર્ટના પાસેથી ઓસ્ટ્રેલીયાની બે કંપલ વિઝીટર વિઝા ફાઇલના કુલ રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- મેળવી લઈ, મુંબઈ ખાતે બોલાવી વિઝાની કોપી નહી આપી, હાઈકોર્ટ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.વી.વાલાણી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૫૧૫/૧૯

ચાંદખેડા: અનિરુદ્ધ સ/ઓ રમેન શર્મા (રહે. સાંઈ શ્રદ્ધા રેસીડન્સી ઉમા પાર્ટી પ્લોટ પાસે મોટેરા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૩/૧૯ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી સોનાના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૩૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ પી.એસ.ચૌધરી ચલાવે છે.

ત્યજી દીઘેલ શીશુ મળી આવવા બાબત:-

સમાચાર યાદી નં.૫૧૬/૧૯

વટવા: તા.૨૦/૦૩/૧૯ કલાક ૧૧/૩૦ પહેલા વટવા ઇન્સાનિયતનગર બ્લોક નંબર-૧૮ મકાન નંબર-૫૪૯ ના રસોડાની ગલેરીમાંથી વટવા પોલીસને ત્યજી દીઘેલ હાલતમાં શીશુ (બાળકી) મળી આવતા અજાણી વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોધી આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી બી.એન.ડાભી ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૫૧૭/૧૯

ગોમતીપુર: મણીબહેન વા/ઓ પ્રાણજીવન પારધી (ઉ.વ.૬૫) (રહે. મહાલક્ષ્મીની ચાલી ટોપીમીલની બાજુમાં ગોમતીપુર) તા.૦૮/૦૩/૧૯ કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાઈમસ ઉપર રસોઈ બનાવતા હતા ત્યારે પ્રાઈમસમાં ભડકો થતા આગ લાગતાં દાઝી ગયા હતા. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તા.૨૦/૦૩/૧૯ કલાક ૧૨/૧૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એમ.મેકવાન ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૫૧૮/૧૯

દરીયાપુર: નિહાલ જાડલહુશેન શેખ (રહે.લકી ટી સ્ટોલ દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૨૦/૦૩/૧૯ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે દરીયાપુર માઢનો મોહલ્લો દિલ્લી ચા વાળાની દુકાનના ઉપરના માળના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે દરીયાપુર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.આર.ગોહીલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.